

GUJARAT BILL NO. 21 OF 2021.

THE GUJARAT PRIVATE UNIVERSITIES (SECOND AMENDMENT) BILL, 2021.

A BILL

further to amend the Gujarat Private Universities Act, 2009.

સન ૨૦૨૧નું ગુજરાત વિધેયક ક્રમાંક: ૨૧.

ગુજરાત ખાનગી યુનિવર્સિટી (દ્વિતીય સુધારા) વિધેયક, ૨૦૨૧.

ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૯ વધુ સુધારવા બાબત વિધેયક.

આથી, ભારતના ગણરાજ્યના બોત્તેરમા વર્ષમાં નીચેનો અધિનિયમ કરવામાં આવે છે:-

૧. (૧) આ અધિનિયમ ગુજરાત ખાનગી યુનિવર્સિટી (દ્વિતીય સુધારા) અધિનિયમ, ૨૦૨૧ કહેવાશે. દેકી સંજ્ઞા
અને
આરંભ.
- (૨) તે સન ૨૦૨૧ના ઓગસ્ટ મહિનાની ૨૫ મી તારીખે અમલમાં આવ્યો હોવાનું ગણાશે.

૨. ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૯ (જેનો આમાં હવે પછી, “મુખ્ય અધિનિયમ” તરીકે ઉલ્લેખ કર્યો છે તે)માં, કલમ ૩માં, પેટા-કલમ (પ)માં, “પુરસ્કર્તા મંડળની ઘટક કોલેજો અને સંસ્થાઓ” એ શબ્દોને બદલે, “સહાયક અનુદાનવાળી કોલેજો અને સંસ્થાઓ સિવાયની, પુરસ્કર્તા મંડળની ઘટક કોલેજો અને સંસ્થાઓ” એ શબ્દો મૂકવા અને તે, ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) અધિનિયમ, ૨૦૨૧ની નિયત તારીખે અને તે તારીખથી મૂક્યા હોવાનું ગણાશે. સન ૨૦૦૯ના
ગુજરાતના ૮મા
અધિનિયમની
કલમ ૩ નો
સુધારો.

૩. (૧) ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વટહુકમ, ૨૦૨૧, આથી રદ કરવામાં આવે છે. રદ કરવા
બાબત અને
અપવાદ.

- (૨) એવી રીતે રદ થવા છતાં, સદરહુ વટહુકમથી સુધાર્યા પ્રમાણેના મુખ્ય અધિનિયમ હેઠળ કરેલ કોઈ કાર્ય અથવા લીધેલ કોઈ પગલું, આ અધિનિયમથી સુધાર્યા પ્રમાણેના મુખ્ય અધિનિયમ હેઠળ કરેલ અથવા લીધેલ હોવાનું ગણાશે.

સન
૨૦૦૯નો
ગુજરાતનો
૮મો.

સન
૨૦૨૧નો
ગુજરાતનો
૧૫મો.

સન
૨૦૨૧નો
ગુજરાત
વટહુકમ
૪ થો.

ઉદ્દેશો અને કારણો

ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) અધિનિયમ, ૨૦૨૧ (સન ૨૦૨૧ના ગુજરાત અધિનિયમ ક્રમાંક. ૧૫ મા)થી, ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૯ની કલમ ૩ની પેટા-કલમ (૫)માં સુધારો કર્યો હતો, જેનાથી સદરહુ પેટા-કલમ (૫)માં આવતા "સહાયક અનુદાનવાળી કોલેજો અને સંસ્થાઓ સિવાયની" એ શબ્દો કમી કર્યા હતાં. તેમ છતાં, સન ૨૦૨૧ના સદરહુ સુધારા અધિનિયમ ક્રમાંક ૧૫ થી સુધાર્યા મુજબની કલમ ૩ના અમલીકરણ દરમિયાન, સન ૨૦૨૧ના સદરહુ સુધારા અધિનિયમ ક્રમાંક. ૧૫ ના આરંભ પૂર્વે યુનિવર્સિટીઓ સાથે સદરહુ કોલેજો અને સંસ્થાઓના જોડાણ અને તેઓએ ભોગવેલા વિશેષાધિકારો પુનઃ સ્થાપિત કરવા માટે, પુરસ્કર્તા મંડળની કેટલીક સહાયક અનુદાનવાળી કોલેજો અથવા સંસ્થાઓ અને કેટલાક બીજા મધ્યસ્થીઓ તરફથી વિવિધ રજૂઆતો મળી છે.

આવી કોલેજો અને સંસ્થાઓ રાજ્ય સરકાર પાસેથી સહાયક અનુદાન મેળવે છે તે હકીકતને ધ્યાને લેતાં, રાજ્ય સરકારને મળેલી સદરહુ રજૂઆતોમાં જણાવેલ તાકીદની વહીવટી જરૂરિયાતોના નિવારણના હેતુસર આવી કોલેજો અને સંસ્થાઓનું, સન ૨૦૨૧ના સુધારા અધિનિયમ ક્રમાંક. ૧૫ ના આરંભ પૂર્વે, જે યુનિવર્સિટીઓ સાથે જોડાણ હતું તે પુનઃ સ્થાપિત કરવું જરૂરી જણાય છે. સદરહુ અધિનિયમની કલમ ૩માં જરૂરી સુધારો કરેલ છે.

તે સમયે ગુજરાત રાજ્યની વિધાનસભાનું સત્ર ચાલુ ન હોવાથી, ઉપર્યુક્ત ઉદ્દેશો સિદ્ધ કરવા માટે ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વટહુકમ, ૨૦૨૧ પ્રસિધ્ધ કર્યો હતો. આ વિધેયકથી, સદરહુ વટહુકમના સ્થાને, રાજ્ય વિધાનમંડળનો અધિનિયમ મૂકવા ધાર્યું છે.

તારીખ: ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૨૧.

જીતુભાઈ વાઘાણી.

પુરવણી
ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૯ (સન ૨૦૦૯ના ગુજરાતના ૮-મા)
માંથી ઉતારા.

૩. (૧) થી (૪) xxx xxx xxx

(૫) પેટા-કલમ (૧) હેઠળ યુનિવર્સિટીની સ્થાપનાની તરત પહેલાં, કોઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન અને તેના વિશેષાધિકારો ભોગવતી પુરસ્કર્તા મંડળની ઘટક કોલેજો અને સંસ્થાઓ તે યુનિવર્સિટી સાથે જોડાયેલી હોતી બંધ થશે અને આવી યુનિવર્સિટીની સ્થાપનાની તારીખથી એવા વિશેષાધિકારો પાછા ખેંચેલા ગણાશે અને અનુસૂચિમાં નિર્દિષ્ટ કરેલા સંબંધિત પુરસ્કર્તા મંડળની તત્સમાન યુનિવર્સિટીના વિશેષાધિકારોમાં દાખલ થયેલ હોવાનું ગણાશે અને એવી તમામ કોલેજો અને સંસ્થાઓ તે યુનિવર્સિટીની ઘટક કોલેજો અને સંસ્થાઓ બનશે.

(૬) અને (૭) xxx xxx xxx

યુનિવર્સિટીની
સ્થાપના અને
સંસ્થાપન.

ગુજરાત વિધાનસભા સચિવાલય

[સન ૨૦૨૧નું ગુજરાત વિધેયક ક્રમાંક: ૨૧.]

ગુજરાત ખાનગી યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૯ વધુ
સુધારવા બાબત વિધેયક.

[શ્રી જીતુભાઈ વાઘાણી,

શિક્ષણ મંત્રીશ્રી]

(સન ૨૦૨૧ના સપ્ટેમ્બર મહિનાની ૨૧મી તારીખે
ગુજરાત સરકારી રાજપત્રમાં પ્રસિદ્ધ કર્યા મુજબ)

ડી. એમ. પટેલ,
સચિવ,
ગુજરાત વિધાનસભા.